

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૭/૦૭/૨૦૧૭ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૪૫૭/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૫ કેસ કરી ૨૦ વ્યક્તિઓને ઝડપી, ૧૯૧ લીટર દેશી દારૂ, ૯ બિયર ટીન અને ૧ સ્કૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૫ કેસ કરી ૩૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૦૫,૯૨૫/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૫૮/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૪૫૯/૧૭

**કાગડાપીઠ:** ઇરફાન હુસેન યાવરખાન ઠાકોર (રહે. રહેમતી મહોલ્લો ફરહાન કિરાણા સ્ટોર્સની સામે અલ્લાહનગર દાણીલીમડા) એ તા.૧૬/૭/૧૭ નારોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૨/૭/૧૭ બપોરના ૩/૦૦ વાગે ઘંટાકર્ણ માર્કેટ ખાતે આવેલ દુકાન નંબર - એમ/૧૨ ની પાસે પાર્કિંગમાંથી અજાણી વ્યક્તિ રિક્ષામાંથી રેડીમેઈડ પેન્ટશર્ટ નુ પાર્સલ કિમત રૂપિયા ૧,૦૦,૪૦૪/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એમ.વાઘેલા ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૪૬૦/૧૭

**શાહીબાગ:** રેખાબહેન વા\ઓ ભુપેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.૩૧) (રહે. અપનાનગર પરમાનગર તાલુકો લખપત જીલ્લો- ભુજ) તા.૧૬/૭/૧૭ સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે રાજસ્થાન હોસ્પિટલ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ રેખાબહેનના ગળામાંથી સોનાનો દોરો કિમત રૂપિયા ૩૧,૦૦૦/- ખેચી તોડી લઈ ગયા હતા. આ અંગેની ફરીયાદ રેખાબહેન પરમારે શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી લાલજીભાઈ ચેહોરભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.